



દ્વીર અને સંભાળદાતા શિક્ષણ

તમારા બાઈલરી ડ્રેઇનેજ કેથેટર વિશે

આ માહિતી તમને એમએસકે ખાતે તમારા પિતૃત (Pitt) નિકાલ નિવેશિકા ગોઠવણીના ઓપરેશન માટે તૈયાર થવામાં મદદ કરશે. તે ઘરે તમારી નિવેશિકાની સંભાળ કેવી રીતે રાખવી તે પણ સમજાવે છે.


તમારી પિતૃત પર્ણાલી વિશે

પિતૃત (બાઈલ) એ તમારા લિવર દ્વારા બનાવવામાં આવતું એક પર્વાહી છે. તે તમને ખોરાકને પચાવવામાં (તોડવામાં) મદદ કરે છે. પિતૃત તમારા યકૃત દ્વારા તમારી પિતૃત નળીઓમાંથી અને તમારા નાના આંતરડામાં વહે છે.

તમારી પિતૃત નળી ધાયલ પેશીઓ અથવા ગાંઠો દ્વારા સંકુચિત અથવા અવરોધિત થઈ શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે પિતૃત તમારા નાના આંતરડાના પર્થમ ભાગમાં વહી શકતું નથી, જેને પક્વાશય (pakvashay) કહેવામાં આવે છે. જ્યારે તમારી પિતૃત નળી સંકોચાય છે અથવા અવરોધિત થાય છે, ત્યારે તે તમારા યકૃતમાં પિતૃતના નિમાર્ણનું કારણ બને છે (આકૃતિ 1 જુઓ).

તમારા યકૃતમાં પિતૃતનું નિમાર્ણ થવાનું કારણ:

- રોગનો ચેપ
- ઉબકા (એવું લાગે છે કે તમને ઉલટી થશે)
- ઉલ્ટી (ઉબકા આવવા)
- તાવ
- ખંજવાળ
- કમળો (જ્યારે તમારી તુવચા અને તમારી આંખો પીળી દેખાય)



આકૃતિ 1. પિતૂતનો સાંકડો અથવા અવરોધિત પર્વાહ

તમારી પિતૂત નિકાલ નિવેશિકા વિશે


જો તમારી પિતૂત નળી અવરોધિત હોય, તો તમારા ડૉક્ટર તમને પિતૂત નિકાલ નિવેશિકા મૂકવાની ભલામણ કરી શકે છે. આ એક પાતળી, લવચીક નળી છે જે તમારા યકૃતમાંથી પિતૂતને બહાર કાઢે છે.

જુદી જુદી 3 રીતે પિતૂત તમારા લિવરમાંથી વહાવી શકાય છે. તમારા ઓપરેશન પહેલાં તમારા ડૉક્ટર તમારી સાથે આ વિશે વાત કરશે.

- એક આંતરિક-બાહ્ય પિતૂત નિકાલ નિવેશિકા તમારી ત્વચામાંથી પસાર થાય છે અને તમારી પિતૂત નળીઓમાં જાય છે. તેને બ્લોકેજની આજુબાજુ મૂકવામાં આવશે (આકૃતિ 2 જુઓ).

આ ઓપરેશન પછી, નિવેશિકાનો એક છેડો તમારા નાના આંતરડાની અંદર મુકવામાં આવશે. નિવેશિકાનો બીજો છેડો તમારા શરીરમાંથી બહાર આવશે. તે નિકાલ બેગ સાથે જોડાયેલ હશે જે તમારા યકૃતમાંથી પિતૂત એકત્રિત કરે છે.


આંતરિક-બાહ્ય પિતૂત નિકાલ નિવેશિકા પિતૂતને 2 દિશામાં વહેવા દે છે. પિતૂત તમારા નાના આંતરડામાં (જેને આંતરિક નિકાલ કહેવામાં આવે છે) અથવા તમારી નિકાલ બેગમાં વહી શકે છે (જેને બાહ્ય નિકાલ કહેવામાં આવે છે).



આકૃતિ 2. ઇન્ટનરલ-એક્સ્ટનરલ બાઇલરી ડરેંજેજ કેથેટર

- એક બાહ્ય પિતૃત નિકાલ નિવેશિકા તમારી ત્વચામાંથી પસાર થાય છે અને તમારી પિતૃત નળીઓમાં જાય છે. તેને બ્લોકેજની ઉપર મૂકવામાં આવશે (આકૃતિ 3 જુઓ).

આ ઓપરેશન પછી તમારા શરીરમાંથી નિવેશિકા નીકળશે. નિવેશિકા એક નિકાલ બેગ સાથે જોડાયેલ હશે જે તમારા યકૃતમાંથી નીકળેલા પિતૃતને એકત્રિત કરે છે.



આકૃતિ 3. એક્સટન્રલ બાઇલરી ડ્રેનેજ કેથેટર

- પિતૂત સ્ટેન્ટિંગ અવરોધિત પિતૂત નળીને ખુલ્લી રાખવા માટે સ્ટેન્ટ (પાતળી, ધાતુની નળી)નો ઉપયોગ થાય છે. સ્ટેન્ટ સાથે અવરોધિત પિતૂત નળી ખોલવાથી પિતૂત તમારા ચકૃતમાંથી બહાર નીકળી જાય છે.

આ ઓપરેશન પછી તમારા શરીરમાંથી નાની નિવેશિકા નીકળી શકે છે. જ્યારે તમારા ડોક્ટર જુએ છે કે તમારું સ્ટેન્ટ સારી રીતે કામ કરી રહ્યું છે, ત્યારે તેઓ નિવેશિકા બહાર કાઢશે.

તમારું પિતૂત નિકાલ નિવેશિકા અથવા પિતૂત સ્ટેન્ટ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ (જેને આઈઆર ડોક્ટર પણ કહેવામાં આવે છે) દ્વારા ફીટ કરવામાં આવશે. આઈઆર ડોક્ટર એ એક ડોક્ટર છે, જેમણે છબી-માગરદશિરૂત ઓપરેશનો કરવાની વિશેષ તાલીમ લીધી છે.

જો તમને પિતૂત નિકાલ નિવેશિકા મૂકવામાં આવી હોય, તો તેને નિકાલ એકત્તિર્ત કરવા માટે બેગ સાથે જોડવામાં આવશે. તમારા આઈઆર ડોક્ટર તમને જણાવશે કે તમારે કેટલા નિકાલની અપેક્ષા રાખવી જોઈએ.

તમે તમારી પિતૃત નિકાલ નિવેશિકા મેળવો તે પહેલાં શું કરવું

તમારી દવાઓ વિશે પૂછો

તમારી કાયર્પર્શાલી પહેલાં તમારે તમારી કેટલીક સામાન્ય દવાઓ લેવાનું બંધ કરવાની જરૂર પડી શકે છે. કઈ દવાઓ લેવાનું બંધ કરવું તમારા માટે સલામત છે તે વિશે તમારા આરોગ્યસંભાળ પરદાતા સાથે વાત કરો.

અમે નીચે કેટલાક સામાન્ય ઉદાહરણો સામેલ કર્યાર્થે, પરંતુ અન્ય છે. એ સુનિશ્ચિત કરો કે તમારી સંભાળ લેનારી ટીમને તમે લો છો તે તમામ પિરસ્સિકર્પ્શન અને ઓવર-ધ-કાઉન્ટર દવાઓ વિશે જાણો છે. પિરસ્સિકર્પ્શન દવા તે છે જે તમે ફક્ત આરોગ્યસંભાળ પરદાતાના પિરસ્સિકર્પ્શન સાથે જ મેળવી શકો છો. ઓવર-ધ-કાઉન્ટર દવાઓ એવી દવા છે જે તમે પિરસ્સિકર્પ્શન વિના ખરીદી શકો છો.



તમારી કાયર્પર્શાલી પહેલાંના દિવસોમાં તમારી દવાઓ પોગ્ય રીતે લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તેમ ન કરો, તો અમારે તમારી કાયર્પર્શાલી રદ કરવાની જરૂર પડી શકે છે.

લોહી પાતળું કરનાર (અન્ટીકોગ્યુલેન્ટ્સ)

લોહી પાતળું કરવું એ એક દવા છે જે તમારા લોહીના ગંઠાવાની રીતને બદલે છે.

જો તમે લોહી પાતળું કરતી દવાઓ લો છો, તો તમારી પર્કિન્યા હાથ ધરતા આરોગ્ય સંભાળ પરદાતાને તમારી પર્કિન્યા પહેલાં શું કરવું તે પૂછો. તેઓ તમને તમારી કાયર્પર્શાલીના અમુક દિવસો પહેલાં દવા લેવાનું બંધ કરવાનું કહી શકે છે. આનો આધાર તમે કેવા પર્કારની કાયર્પર્શાલી કરી રહ્યા છો અને તમે લોહી પાતળું કરવાની દવા કયા કારણસર લઈ રહ્યા છો તેના પર રહેલો છે.

સામાન્ય લોહીને પાતળા કરનારના ઉદાહરણો નીચે દર્શાવ્યા છે. અન્ય પણ છે, તેથી ખાતરી કરો કે તમારી સંભાળ લેનારી ટીમ તમે લો છો તે તમામ દવાઓ વિશે જાણો છે. તમારી સંભાળ ટીમના કોઈ સભ્ય સાથે વાત કરાર વિના તમારી લોહી પાતળું કરવાની દવા લેવાનું બંધ કરશો નહીં.

- એપિક્સાબન (Eliquis®)
- એસ્સિપ્રિન
- સેલેકોક્સબ (Celebrex®)
- સિલોસ્ટેઝોલ (Pletal®)
- ક્લોપિડોગ્રેલ (Plavix®)
- ડેબીગાટર્સન (Pradaxa®)
- ડેલ્ટેપરિન (Fragmin®)
- મેલોક્સીકેમ (Mobic®)
- નોનસ્ટીરોઇડલ બળતરા વિરોધી દવાઓ (NSAIDs), જેમ કે આઇબુપ્રોફેન (Advil®, Motrin®) અને નેપરોક્સેન (Aleve®)
- પેન્ટોક્લિસફેલાઇન (Trental®)
- પરાસુગરેલ (Effient®)
- રીવારોક્સાબન (Xarelto®)

- ડિપાયરિડામોલ (Persantine®)
- એડોક્સાબન (Savaysa®)
- એનોક્સાપરીન (લવનોક્સ®)
- ફોન્ડાપરિનક્સ (Lovenox®)
- હેપરિન (તમારી ત્વચાની નીચે આપવામાં આવેલ)
- સલ્ફાસલાજીન (Azulfidine®, Sulfazine®)
- ટિકાગરેલોર (Brilinta®)
- ટિન્જાપારિન (Innohep®)
- વોરફરીન (Jantoven®, Coumadin®)

અન્ય દવાઓ અને સપ્લીમેન્ટ તમારા લોહીના ગંઠાઈ જવાની રીતને બદલી શકે છે. ઉદાહરણોમાં શામેલ છે વિટામિન E, ફિશ ઓઇલ અને બળતરાનું શમન કરતી નોનસ્ટીરોઇડ દવાઓ (NSAIDs). આઇબુપ્રોફેન (એડવિલ®, મોટરીન®) અને નેપરોક્સેન (અલેવે®) એ NSAIDs ના ઉદાહરણો છે, પરંતુ તે સિવાય અન્ય ઘણી દવાઓ છે.

વાંચો \How To Check if a Medicine or Supplement Has Aspirin, Other NSAIDs, Vitamin E, or Fish Oil (www.mskcc.org/cancer-care/patient-education/common-medications-containing-aspirin-and-other-nonsteroidal-anti-inflammatory-drugs-nsaids). તે તમને એ જાણવામાં મદદ કરશે કે તમારે તમારી સજર્રી પર્કિર્યા પહેલા કર્દ દવાઓ લેવાનું ટાળવું જોઈએ.

ડાયાબિટીસની દવાઓ

જો તમે ઇસ્યુલિન અથવા ડાયાબિટીસની અન્ય દવાઓ લો છો, તો તમારે કાયરપરણાલી પહેલાં શું કરવું તે અંગે પિરસ્કરાઇબ કરનાર આરોગ્ય સંભાળ પરદાતાને પૂછો. તમારે તેને લેવાનું બંધ કરવાની અથવા સામાન્ય કરતા અલગ ડોઝ (જથ્થો) લેવાની જરૂર પડી શકે છે. તમારે તમારી કાયરપરણાલી પહેલાં ખાવા-પીવા અંગેની વિવિધ સૂચનાઓનું પાલન કરવાની પણ જરૂર પડી શકે છે. તમારા આરોગ્ય સંભાળ પરદાતાની સૂચનાઓનું પાલન કરો.

તમારી સંભાળ ટીમ તમારા ઓપરેશન દરમિયાન તમારા લોહીમાં શકરૂના સ્તરને ચકાસશે.

Weight loss medicines

If you take medicine for weight loss, ask the healthcare provider doing your procedure what to do before your procedure. You may need to stop taking it, follow different eating and drinking instructions before your procedure, or both. Follow your healthcare provider's instructions.

Examples of medicines that cause weight loss are listed below. There are others, so make sure your care team knows all the medicines you take. Some of these are meant to be used to help manage diabetes but are sometimes prescribed just for weight loss.

- Semaglutide (Wegovy®, Ozempic®, Rybelsus®)
- Liraglutide (Saxenda®, Victoza®)
- Tirzepatide (Zepbound®, Mounjaro®)
- Empagliflozin (Jardiance®)
- Dulaglutide (Trulicity®)

મૂતરવધક દવા (પાણીની ગોળીઓ)

મૂતરવધક પદાથર એ એક દવા છે જે તમારા શરીરમાં પરવાહી નિમારણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

જો તમે મૂતરવધક દવા લો છો, તો તમારી કાયરપ્રણાલી હાથ ધરી રહેલા આરોગ્ય સંભાળ પરદાતાને તમારી કાયરપ્રણાલી પહેલાં શું કરવું તે પૂછો. તમારે તમારી કાયરપ્રણાલીના દિવસે તેને લેવાનું બંધ કરવાની જરૂર પડી શકે છે.

સામાન્ય મૂતરવધક પદાથરના ઉદાહરણો નીચે દર્શાવ્યા છે. આ ઉપરાંત પણ ઘણું બધું છે, તેથી એ ખાતરી કરો કે તમારી સંભાળ લેનારી ટીમ તમે લો છો તે તમામ દવાઓથી વાકેફ હોય.

- બ્યુમેટાનાઈડ (Bumex®)
- કુરોસેમાઈડ (Lasix®)
- હાઇડ્રોક્લોરોથિયાજાઈડ (Microzide®)
- સ્લ્યુપરોનોલેક્ટોન (Aldactone®)

જો તમને ભૂતકાળમાં કોન્ટ્રાસ્ટ ડાઇથી એલજીર્ક રિએક્શન થયું હોય તો તમારા આઇઆર ડોક્ટરને જણાવો. આ તે ડોક્ટર છે જે તમારી પિતૃત નિકાલ નિવેશિકાની ગોઠવણીનું ઓપરેશન કરી રહ્યા છે. એલજીર્માં મદદરૂપ થવા માટે તમારે તમારા ઓપરેશન પહેલાં દવા લેવાની જરૂર પડી શકે છે.

તમારી ત્વચા પરથી ઉપકરણને દૂર કરો

તમે તમારી ત્વચા પર ચોક્કસ ડિવાઇસો પહેરી શકો છો. તમારું સ્કેન અથવા પર્કિર્યા પહેલાં, ડિવાઇસ બનાવનાર ભલામણ કરે છે કે તમે તમારા ડિવાઇસ ઉતારો:

- સતત ગ્લુકોઝનું મોનિટરિંગ (CGM)
- ઇન્સ્યુલિન પંપ

તમારે તમારા ઉપકરણને બદલવાની જરૂર હોય તે તારીખની નજીક તમારી અપોઇન્ટમેન્ટના શેડ્યુલ વિશે તમારા આરોગ્યસંભાળ પરદાતા સાથે વાત કરો. ખાતરી કરી લો કે તમારી પાસે તમારી સ્કેન અથવા પર્કિર્યા પછી ચાલુ કરવા માટે તમારી સાથે એક વધારાનું ઉપકરણ છે.

જ્યારે તમારું ડિવાઇસ બંધ હોય ત્યારે તમારા ગ્લુકોઝનું સંચાલન કેવી રીતે કરવું તે વિશે તમને ખાતરી ન હોઈ શકે.

જો એમ હોય તો, તમારી એપોઇન્ટમેન્ટ પહેલાં, તમારી ડાયાબિટીસની કાળજીનું સંચાલન કરતા આરોગ્યસંભાળ પરદાતા સાથે વાત કરો.

કોઈ તમને ઘરે લઈ જાય તે માટેની વ્યવસ્થા કરવી

ઓપરેશન પછી તમને ઘરે લઈ જવા માટે તમારી સારવાર કરનાર જવાબદાર વ્યક્તિ હોવો આવશ્યક છે. સારવાર કરનાર જવાબદાર વ્યક્તિ તે છે જે તમને સલામત રીતે ઘરે પહોંચવામાં મદદ કરી શકે છે. જો તેમને કોઈ ચિંતા હોય તો તેઓ તમારી સારવાર ટીમનો સંપક્રકર કરવા માટે સમથર્હ હોવા જોઈએ. તમારા ઓપરેશનના દિવસ પહેલાં તેનું આયોજન કરવાની ખાતરી કરો.

જો તમારી પાસે ઘરે લઈ જવા માટે સારવાર કરનાર જવાબદાર વ્યક્તિ ન હોય, તો નીચેની કોઈ એક એજન્સીનો સંપક્રકર કરો. તેઓ તમારી સાથે ઘરે જવા માટે કોઈને મોકલશે. આ સેવા માટે શુલ્ક છે અને તમારે પરિવહન પૂરું પાડવું પડશે. ટેક્સી અથવા કાર સેવાનો ઉપયોગ કરવો એ બરાબર છે, પરંતુ તમારે હજી પણ તમારી સારવાર કરનાર જવાબદાર વ્યક્તિની જરૂર છે.

ન્યૂ યોકર્સમાં એજન્સીઓ

વીએનએસ (VNS) સ્વાસ્થ્ય: 888-735-8913

સંભાળ રાખનારા લોકોના સંપક્રકર નં.: 877-227-4649

ન્યૂ જસીર્સમાં એજન્સીઓ

સંભાળ રાખનારા લોકોના સંપક્રકર નં.: 877-227-4649

જો તમે બીમાર હોવ તો અમને જણાવો

જો તમે તમારા ઓપરેશન પહેલાં બીમાર (તાવ, શરદી, ગળામાં દુઃખાવો અથવા ફ્લૂ સહિત) પડો, તો તમારા આઈઆર ડોક્ટરનો સંપક્રકર કરો. તમે તેમને સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કોલ કરી શકો છો.

સાંજે 5 વાગ્યા પછી, શનિ-રવિ અને રજાઓમાં, 212-639-2000 પર કોલ કરો. કોલ પર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ફેલો માટે પૂછો.

તમારી એપોઇન્ટમેન્ટનો સમય નોંધો

સ્ટાફનો એક સભ્ય તમારા ઓપરેશન 2 કામકાજના દિવસો પહેલાં તમને કોલ કરશે. જો તમારું ઓપરેશન સોમવારે નક્કી કરવામાં આવ્યું હોય, તો તેઓ તમને ગુરુવાર પહેલાં કોલ કરશે. તેઓ તમને જણાવશે કે તમારા ઓપરેશન માટે કયા સમયે હોસ્પિટલમાં જવું જોઈએ. તેઓ તમને એ યાદ પણ કરાવશે કે ક્યાં જવું.

તમારા ઓપરેશનની તારીખ, સમય અને સ્થાનને લખવા માટે આ વિસ્તારનો ઉપયોગ કરો:

જો તમને તમારા ઓપરેશનના એક કામકાજના દિવસના મધ્યાહ્નને (બપોરે 12 વાગ્યે) સુધીમાં કોલ ન આવે, તો 646-677-7001 પર કોલ કરો. જો કોઈ કારણસર તમારે તમારી પરોસીજર રદ કરવાની જરૂર પડે તો જે સ્વાસ્થ્ય સારવાર પરદાતાએ તમારા માટે તેને નિધારારિત કરી હતી એમને કોલ કરો.

તમે તમારી પિતૃત નિકાલ નિવેશિકા મેળવો તે પહેલાંના દિવસે શું કરવું

ખાવા-પીવા માટેની સૂચનાઓ



તમારી સજર્રીની આગલી રાતરે મધરાતેથી (રાતરે 12 વાગ્યે) ખાવાનું બંધ કરી દો. જેમાં હાડ્ર કેન્ડી (પિપરમેન્ટ) અને ચ્યુઇંગમનો સમાવેશ થાય છે.

જો તમારા આરોગ્ય પરદાતા તમને મધ્યરાતિર પહેલાં જમવાનું બંધ કરવાનું કહ્યું હોય, તો તેમની સૂચનાઓનું પાલન કરો. કેટલાક લોકોએ સજર્રી પહેલાં લાંબા સમય સુધી ઉપવાસ (જમવું નહીં) કરવાની જરૂર હોય છે.

જે દિવસે તમને તમારી પિતૃત નિકાલ નિવેશિકા મળશો તે દિવસે શું કરવું

ખાવા-પીવા માટેની સૂચનાઓ

મધરાત (રાતરે 12 વાગ્યાથી) તમારા આગમન સમયના 2 કલાક પહેલાં સુધી, નીચે દશાર્વેલા પરવાહી જ પીવો. બીજું કંઈ ખાવું કે પીવું નહીં. તમારા આગમન સમયના 2 કલાક પહેલાં પીવાનું બંધ કરો.

- પાણી.
- સ્વચ્છત સફરજનનો રસ, સ્વચ્છત દ્રાક્ષનો રસ અથવા સ્વચ્છત કરેનબેરોનો રસ.
- ગોટોરેડ અથવા પાવરેડ.
- બ્લેક કોકી કે સાદી ચા. ખાંડ ઉમેરવી ઠીક છે. બીજું કશું ઉમેરશો નહીં.
 - કોઈપણ પરકારનું દૂધ અથવા કરીમર કોઈપણ માતરામાં ઉમેરશો નહીં. જેમાં છોડ આધારિત દૂધ અને કરીમરનો સમાવેશ થાય છે.
 - મધ ઉમેરશો નહીં.
 - ફૂલેવરવાળા સીરપ ઉમેરશો નહીં.

જો તમને ડાયાબિટીસ હોય તો આ પીણાંમાં કેટલી માતરામાં ખાંડ છે તેના પર ધ્યાન આપો. જો તમે આ પીણાંમાં ખાંડ રહિત, ઓછી ખાંડવાળું અથવા ખાંડ વગરના વજરનો સમાવેશ કરો છો, તો તમારા રક્તમાં ખાંડનાં સ્તરને નિયંત્રિત કરવાનું સરળ બનશે.

સજર્રી પહેલાં હાઇડરેટેડ રહેવું મદદરૂપ થાય છે, તેથી જો તમને તરસ લાગી હોય તો પાણી પીવો. તમારી જરૂરિયાત કરતા વધારે પીવું નહીં. તમારી સજર્રી દરમિયાન તમને ઇન્ટરાવેન્સ (IV) પરવાહી આપવામાં આવશે.



તમારા આગમન સમયના 2 કલાક પહેલાં પીવાનું બંધ કરો. આમાં પાણીનો પણ સમાવેશ થાય છે.

યાદ રાખવાની બાબતો

- તમારા ઓપરેશનની સવારે તમારી દવાઓઓ લેવા માટે તમારા આરોગ્ય સંભાળકતારાંઓની સૂચનાઓનું પાલન કરો. પાણીના થોડા નાના ઘૂંઠા સાથે આને લેવી ઠીક છે.
- બોડી કરીમ, લોશન અથવા પેટરોલિયમ જેલી (વેસેલિન® લગાવશો નહીં. તમે ડિઓડરન્ટ્રૂસ અને ચહેરાના મોઇશ્યરાઇઝરનો ઉપયોગ કરી શકો છો. આંખોમાં કોઈ મેક-અપ ના કરો.
- ધાતુની કોઈ પણ વસ્તુ ન પહેરવી. શરીરના વીધેલા સહિત તમામ દાગીના ઉતારી લો. તમારા ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો જો ધાતુને સ્પર્શેર તો તમે બળી શકો છે.
- કિંમતી ચીજવસ્તુઓ ઘરે જ રાખી દો.
- જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો શક્ય હોય તો તેના બદલે તમારા ચશ્મા પહેરો. જો તમારી પાસે ચશ્મા ન હોય, તો તમારા કોન્ટેક્ટ લેન્સ માટે કવર લાવો.
- કેટલાક આરામદાયક અને ઢીલા ફ્રિટિંગવાળા કપડાં પહેરો.
- જ્યારે તમારા ઓપરેશનનો સમય થાય ત્યારે, ત્યારે તમારે કોઈ પણ શરૂવણ ઉપકરણો, દાંતર, ફૃતિર્મ ઉપકરણો, વિગ અને ધામિસ્ક વસ્તુઓને કાઢી નાખવી જોઈએ.

શું સાથે લાવવું

- પિરસિક્રૂપ્શન અને ઓવર-ધ-કાઉન્ટર દવાઓ, પેચો અને કરીમ સહિત તમે ઘરે લો છો તે તમામ દવાઓની યાદી.
- શ્વાસની સમસ્યાઓ માટેની દવાઓ (જેમ કે તમારું ઇન્હેલર), છાતીમાં દુખાવા માટેની દવાઓ અથવા બંને.
- તમારો સેલફોન અને ચાજરૂર.
- અખબારો જેવી નાની ખરીદી માટે તમારે ફક્ત પૈસાની જરૂર પડશે.

- જો તમારી પાસે કોઈ વ્યક્તિગત વસ્તુ છે, તો તેના માટે એક કવર. ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સ, કોઈ પણ શરૂઆત ઉપકરણો, દાંતર, ફૃતિર્મ ઉપકરણો, વિગ અને ધામિર્ક વસ્તુઓ એ વ્યક્તિગત વસ્તુઓના ઉદાહરણો છે.
- તમારું આરોગ્ય સંભાળ પરોક્ષી ફોમર અને અન્ય આગોતરી સૂચનાઓ, જો તમે તેમને ભયાર હોય.
- તમારું શ્વાસ લેવાનું ઉપકરણ સ્લીપ એપનિયા (જેમ કે તમારું સીપીએપી મશીન) માટે જો તમે તેનો ઉપયોગ કરો. જો તમે તેને લાવી શકતા નથી, તો અમે તમને તમારા હોસ્પિટલમાં રોકાણ દરમિયાન ઉપયોગ માટે એક આપીશું.

જ્યારે તમે આવો ત્યારે શું અપેક્ષા રાખવી

ઘણા ડોક્ટરો, નસોર અને અન્ય સ્ટાફના સભ્યો તમને તમારું નામ અને જન્મ તારીખ બોલવા અને લખવાનું કહેશે. આ તમારી સલામતી માટે છે. આ જ નામના અથવા તેના જેવા નામના બીજા લોકોની પણ આ દિવસે પ્રક્રિયા કરવાની હોઈ શકે છે.

એક વખત તમને ઓપરેશન પહેલાંના વિસ્તારમાં લાવવામાં આવ્યા બાદ તમને હોસ્પિટલનું ગાઉન અને પહેરવા માટે લપસો નહિ તેવાં મોજાં મળી જશે. જો તમારી પાસે કોઈ શરૂઆત ઉપકરણો, દાંતર, ફૃતિર્મ ઉપકરણો, વિગ અને ધામિર્ક વસ્તુઓ હોય તો તેને કાઢવા માટે કહેવામાં આવશે.

નસર સાથેની મુલાકાત

તમારા ઓપરેશન પહેલાં તમે એક નસરને મળશો. તેમને જણાવો કે તમે મધ્યરાત્રિ (રાતરે 12 વાગ્યે) પછી કર્દ દવા લીધી છે અને તમે તેને કેટલા વાગ્યે લીધી છે. પિર્સિક્રેપ્શન અને ઓવર-ધ-કાઉન્ટર દવાઓ, પેચો અને કરીમનો સમાવેશ કરવાનું સુનિશ્ચિયત કરો.

તમારી નસર તમારી ભુજા અથવા હાથની નસમાં ઇન્ટરાવેન્સ (IV) લાઇન મૂકશો, જિવાય કે તમારી પાસે પહેલેથી જ હોય:

- સેન્ટ્રલ વેનસ કેથેટર (સીવીસી) અથવા અન્ય પર્કારની સીવીસી .
- પેરિફેરલલી ઇન્સટેરડ સેન્ટ્રલ કેથેટર (પીઆઇસીસી).
- પર્સ્ટ્ર્યારોપિત કરાયેલું પોટર (જેને મેડિપોટર અથવા પોટર-એ-કેથ પણ કહેવામાં આવે છે).

તમારા ઓપરેશન દરમિયાન તમને એનેસ્થેસિયા (ઊંઘ પરેક દવા) આપવામાં આવશે. તે IV લાઇન, સીવીસી, પીઆઇસીસી લાઇન અથવા પર્સ્ટ્ર્યારોપિત પોટર દ્વારા આપવામાં આવશે. તમે તમારા ઓપરેશન પહેલાં આઈવી લાઇન, સીવીસી, પીઆઇસીસી લાઇન અથવા પર્સ્ટ્ર્યારોપિત કરેલા પોટર મારફતે પણ પર્વાહી મેળવી શકો છો.

એનેસ્થેસિયોલોજિસ્ટ સાથેની મુલાકાત

તમે એનેસ્થેસિયોલોજિસ્ટ (A-nes-THEE-zee-AH-loh-jist) સાથે પણ મુલાકાત કરશો. એનેસ્થેસિયોલોજિસ્ટ એનેસ્થેસિયાની વિશેષ તાલીમ ધરાવતા ડૉક્ટર છે. તેઓ તમને તમારા ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા આપશો. તેઓ નીચે મુજબનું કાયર્ પણ કરશો:

- તેમની સાથે તમારા તબીબી ઇતિહાસની સમીક્ષા કરો.
- પૂછો કે શું તમને ભૂતકાળમાં એનેસ્થેસિયાથી કોઈ સમસ્યા આવી છે. આમાં ઉબકા (તમને ઉલટી થાય છે તેવું લાગવું) અથવા પીડાનો સમાવેશ થાય છે.
- તમારા ઓપરેશન દરમિયાન તમારી અનુકૂળતા અને સલામતી વિશે તમારી સાથે વાત કરશો.
- તમને કયા પરકારનું એનેસ્થેસિયા આપવામાં આવશો તે વિશે તમારી સાથે વાત કરશો.
- એનેસ્થેસિયા વિશેના તમારા પરશુનોના જવાબ આપશો.

ડૉક્ટર સાથે મુલાકાત કરો

તમારા ઓપરેશન પહેલાં, તમે આઇઆર ડૉક્ટરને મળશો જે પિતૃત નિકાલ નિવેશિકા મૂકશો. તેઓ તમને પરકિર્યા સમજાવશે અને તમારા પરશુનોના જવાબ આપશો. તમને સંમતિ પતરક પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવશે, જે કહે છે કે તમે ઓપરેશન માટે સંમત છો અને જોખમોને સમજો છો.

ઓપરેશન રૂમમાં

તમારી સંભાળ ટીમના એક સભ્ય તમને ઓપરેશન ટેબલ પર અને સંપૂણાર સિથ્યતિમાં લાવવામાં મદદ કરશો. તે તમને તમારી IV લાઇન, સીવીસી, પીઆઇસીસી લાઇન અથવા પર્યારોપિત પોટર મારફતે એનેસ્થેસિયા આપશો. બેભાન કરવાથી તમને ઉઘ આવે છે અને આરામદાયક લાગે છે.

ત્યારબાદ, તેઓ તમારા પેટ (પેટ)ને જીવાણુનાશક દરાવણથી સાફ કરશો, જે જંતુઓ અને બેક્ટેરિયાને મારી નાખે છે. તે પછી, તેઓ તમને સ્થાનિક એનેસ્થેટિક આપશો જેથી તે વિસ્તારને સુન્ન કરી શકાય જ્યાં તેઓ પિતૃત નિકાલ નિવેશિકા મૂકશો. તમને એનેસ્થેટિક ઇન્જેક્શન (શોટ) તરીકે મળશો.

એક વખત સ્થાનિક એનેસ્થેટિક અને બેભાન કરવાની પરકિર્યા કાયર્રત થઈ જાય પછી તમારા આઇઆર ડૉક્ટર આ ઓપરેશન શરૂ કરી દેશે. તેઓ નિવેશિકા મૂકવામાં મદદ કરવા માટે ફ્લોરોસ્કોપી (રીઅલ-ટાઇમ એક્સ્સ-રે) અથવા અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરશો. અલ્ટ્રાસાઉન્ડ એ એક ઇમેન્જિંગ સ્કેન છે જે તમારા શરીરની અંદરના ચિતરો બનાવવા માટે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે.

તમારા ડૉક્ટર તમને કોન્ટરાસ્ટ ડાઇનું ઇન્જેક્શન પણ આપી શકે છે. ડાઇ તે વિસ્તારને જોવાનું સરળ બનાવે છે જ્યાં નિવેશિકા મૂકવામાં આવશે.

તેઓ તમારી નિવેશિકા મૂકશો તે પછી તમારા આઇઆર ડૉક્ટર નિવેશિકાની ફરતે સિલિકોન ડિસ્ક મૂકશો (આકૃતિ 4

જુઓ). આ ડિસ્ક ચીકણા (ચોટી જાય એવા) ડરેસિંગનો ઉપયોગ કરીને તમારી તૃવ્યા પરની નિવેશિકાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. નિવેશિકાને તેની જગ્યાએ જાળવી રાખવામાં મદદરૂપ થવા માટે ટાંકા પણ લેવામાં આવી શકે છે.

તમે તમારી પિતૃત નિકાલ નિવેશિકા મેળવ્યા પછી

તમારા ઓપરેશન પછી, તમારી સંભાળ ટીમના એક સભ્ય તમને પોસ્ટ-એનેસ્થેસિયા કેર ચુનિટ (પીએસીયુ)માં લઈ આવશે. જ્યારે તમે શામક દવાની અસર પૂરી થાય પછી જાગો છો ત્યારે નસ્ર તમારી તપાસ કરશે અને તમારી સંભાળ લેશે.

તેઓ તમારા શરીરના તાપમાન, ધબકારા, બ્લિડ પરેશર અને ઓક્સિજનના સ્તરનું નિરીક્ષણ કરશે. તેઓ કોઈપણ રક્તસરાવ માટે તમારી નિવેશિકાના સ્થાનનું પણ નિરીક્ષણ કરશે. શામક દવાની અસર પૂરી ન થાય ત્યાં સુધી તમારે પથારીમાં રહેવાની જરૂર રહેશે. મોટાભાગના લોકો ઓછામાં ઓછી 1 કલાક માટે પીએસીયુમાં રહે છે.

તમારી ઓપરેશન પછી તમને થોડી પીડા થઈ શકે છે. જો તમે તેમ કરો છો, તો તમારી પીડાને ઓછી કરવા માટે તમારી નસ્ર પાસે દવા માગો.


મોટાભાગના લોકો કે જેમણે નવી પિતૃત નિકાલ નિવેશિકા લગાવ્યા છે તેઓએ આખી રાત હોસ્પિટલમાં જ રોકાઈ ગયા છે. જો તમારે આખી રાત રોકાવાની જરૂર નથી, તો તમે તમારા ઓપરેશનના તે જ દિવસે હોસ્પિટલમાંથી નીકળી શકો છો.

તમે હોસ્પિટલ છોડતા પહેલાં તમારી નસ્ર અને તમારા સંભાળકતાર સાથે ડિસ્યાજર્ની સૂચનાઓની સમીક્ષા કરશે. તેઓ તમને તમારી નિવેશિકાની સંભાળ રાખવા માટે સમાન પણ આપશે. તેઓએ તમને 2 અઠવાડિયા સુધી ચાલવા માટે પૂરતો પુરવઠો આપવો જોઈએ. વધુ પુરવઠો મેળવવા અંગેની માહિતી માટે “તમારા પિતૃત નિકાલ નિવેશિકા સપ્લાયનો ઓડરર કેવી રીતે આપવો” વિભાગ વાંચો.

તમારી પિતૃત નિકાલ નિવેશિકા વિશે

તમારી નિવેશિકા પર સિલિકોન ડિસ્કની ટોચ પર કાળી શાહીનું નિશાન હશે (આકૃતિ 4 જુઓ). તમારી નસ્ર તમને એ બતાવશે.


આ નિશાન હુંમેશા ડિસ્કના ઉપરના ભાગથી સરખા અંતરે હોવું જોઈએ. જો તે બદલાય છે, તો આનો અથર એ છે કે નિવેશિકા ખસી ગયી છે. તમારે તમારા આઈઆર ડોક્ટરની ઓક્સિમાં કોલ કરવાની જરૂર પડશો જેથી ત્યાં કોઈ તેને ચકાસી શકે.



આકૃતિ 4. ડિસ્કની ઉપર કાળી શાહીનું નિશાન

તમારી નિવેશિકાનો બાહ્ય (બહારનો) છેડો 3-માગીર્ય સ્ટોપકોક સાથે જોડાયેલો હશે (આકૃતિ 5 જુઓ). તેને 3-વે સ્ટોપકોક કહેવામાં આવે છે કારણ કે તેમાં જોડાણના 3 બિંદુઓ (જેને પોટર્ કહેવામાં આવે છે) છે. તેમાં એક નળ પણ છે જે નિવેશિકામાંથી પસાર થતા પરવાહીની દિશાને નિયંત્રિત કરવા માટે ફેરવી શકાય છે.

નિકાલ બેગ તમારી નિવેશિકાની સામેના પોટર્ સાથે જોડાયેલ હશે. કેન્દ્રરીય પોટર્ પર એક સુરક્ખાત્મક કવર છે, જેનો ઉપયોગ તમે પરવાહી દાખલ કરવા માટે કરી શકો છો. આ કવરને સોથરહિત કનેક્ટર કહેવામાં આવે છે.



આકૃતિ 5. 3-માગીર્ય સ્ટોકપોક

તમારી પાસે એક ડ્રેઇનેજ બેગ રહેશે જે તમારી કેથેટર સાથે જોડાયેલ રહેશે. તમે બેગની અંદર પિતૃત (લીલા-પીળા રંગનું પરવાહી) વહેતું જોઈ શકશો. તમારા ઓપરેશન પછી 1 થી 2 દિવસ સુધી પિતૃત લોહિયાળ દેખાઈ શકે છે. સમય જતાં, તે સોનેરી પીળો અથવા લીલો થઈ જશે, જે તમારા શરીરની અંદર નિવેશિકા ક્ર્યાં છે તેના પર આધાર રાખે છે.

નિકાલ બેગ સલામતી પિનથી તમારા કપડાંના કમરપટ્ટા સાથે જોડી શકાય છે. અથવા, તેને વેલકરો® પટ્ટાઓ વડે

તમારા પગ સુધી સુરક્ષિત કરી શકાય છે. બેગના નીચેના ભાગમાં એક ટિવસ્ટ કેપ (નિકાલ પોટર) છે, જેનો ઉપયોગ તમે બેગને ખાલી કરવા માટે કરશો.

કેથગરીપ® એક એવું ઉપકરણ છે જે તમારી નિવેશિકાને તેની જગ્યાએ રાખવામાં મદદ કરે છે. જો તમે ભૂલથી તેને ખેચશો તો તે તમારી નિવેશિકાને તમારા શરીરમાંથી બહાર આવવા દેશે નહીં. કેથગરીપ તમારી નિવેશિકા અને નળીને ખેચતા, લંબાવતા અથવા વાળતા (વળાંક લેતા અથવા વળી જતા) અટકાવવામાં મદદરૂપ થશે.

તમારી પિતૃત નિકાલ નિવેશિકાની સંભાળ રાખવી

તમારા કેથેટરની સાર-સંભાળ કેવી રીતે લેવી તે તમારી નસર્ તમને શીખવશો. તમે જે શીખ્યા તેને યાદ કરવા ઘરમાં આ રિસોસરનો ઉપયોગ કરો.

જો જરૂરી હોય તો, તમારી સંભાળ ટીમ મુલાકાતી નસરને તમારા ઘરે પહોંચવાની વ્યવસ્થા કરવા માટે તમારી સાથે કામ કરી શકે છે. આ નસર મુલાકાતી નસર સેવાની હશે, એમએસકેની નહીં. જ્યાં સુધી તમે અથવા તમારા સંભાળકતારને તે જાતે કરવાનું યોગ્ય ન લાગે ત્યાં સુધી તેઓ તમને તમારી નિવેશિકાની સંભાળ લેવામાં મદદ કરશો.

દરરોજ તમે આટલું કરશો:

- તમારી નિવેશિકાનીને ચકાસો.
- સાદા પાણી વડે કેથેટરને સાફ કરશો.
- નિકાલ બેગમાંથી નિકાલ ખાલી કરો.
- તમે કરેલ નિકાલની માતરા લખો.

તમારે અઠવાડિયામાં એકવાર તમારી ડરેસિંગ અને નિકાલ બેગ બદલવી જ જોઈએ. જો તમારું ડરેસિંગ ઢીલું, ભીનું અથવા ગંદું થઈ જાય, તો તમારે તેને પણ બદલવાની જરૂર પડશો. જો તમારું ડરેસિંગ ભીનું થઈ જાય અને તમે તેને જેમ છે તેમ છોડી દો, તો તમારી ત્વચા બળી શકે છે અને દુખાવો થઈ શકે છે.

તમારી ડરેસિંગ અને નિકાલ સિસ્ટમ બદલવામાં તમારી સહાય માટે તમારે કોઈની જરૂર પડી શકે છે. તમે તમારી નિવેશિકાને ચકાસી શકશો અને તેને જાતે જ સામાન્ય ક્ષારથી ફૂલશ કરી શકશો.

તમારી નિવેશિકામાંથી બહાર આવતા પર્વાહીનું પરમાણ હંમેશાં એકસરખું ન હોઈ શકે. જો તમે 1 દિવસમાં 500 મિલિલિટર (એમએલ)થી વધુ પાણીનો નિકાલ કરો છો, તો તમારા આઈઆર ડોક્ટર સાથે વાત કરો.

તેઓ તમને કહેશો કે તમે નિકાલમાં ગુમાવી રહ્યા છો તે પર્વાહી અને ક્ષારને બનાવવા માટે શું પીવું જોઈએ. હંમેશાની જેમ, હાઇડ્રેટ રહેવું (પુષ્ટકળ પરમાણમાં પર્વાહી લેવું) અને સંતુલિત આહાર લેવો મહત્વપૂર્ણ છે.

તમારી પિતૃત નિકાલ નિવેશિકાને કેવી રીતે તપાસવી

તમારે દરરોજ તમારી નિવેશિકાને તપાસવી જ જોઈએ. તમે આ કામ હાથમાં રાખી શકાય તેવા અરીસા, પૂણર્લંબાઈના અરીસા અથવા બંનેનો ઉપયોગ કરીને કરી શકો છો.

1. તે યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તેની ખાતરી કરવા માટે, કાળી શાહીનું નિશાન શોધો (આકૃતિ 4 જુઓ). તે હંમેશાં ડિસ્કની ટોચથી સમાન અંતરે હોવું જોઈએ. જો અંતર બદલાય છે, તો આનો અથર્ડ એ છે કે નિવેશિકા ખસી ગઈ છે. તમારા આઈઆર ડોક્ટરની ઓફિસમાં કોલ કરો જેથી ત્યાં કોઈ તેને ચકાસી શકે.
2. ડ્રેસિંગ સુરક્ષિત છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે તેને ચકાસો. જો ડ્રેસિંગ ભીનું, ગંદુ, ઢીલું હોય અથવા તમારી ત્વચાથી દૂર ખસી રહ્યું હોય તો તેને બદલો.
3. જ્યારે તમે ડ્રેસિંગ બદલી રહ્યા હોવ ત્યારે તમારી નિવેશિકાની આસપાસની ત્વચાને જુઓ. તે સારી સ્થિતિમાં છે તે જોવા માટે તપાસો. ત્વચા પર લાલાશ, ત્વચા પર ચીરા અથવા ચકામાના નિશાન ન હોવા જોઈએ. તમારી નિવેશિકાની આસપાસ કોઈ પર્વાહી લિક ન થવું જોઈએ.
4. નિકાલ બેગમાં રહેલા પિતૃને જુઓ. તે બેગમાં મુક્તપણો વહેતું હોવું જોઈએ. જે રીતે એ કામ કરતું દેખાય છે એમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. જો પિતૃ ઓછું હોય અથવા પિતૃનો રંગ બદલાય છે, તો તમે પૂરતા પરમાણમાં પર્વાહી પીતા ન હોવ તેવું બની શકે છે. દરરોજ 8 (8-ઔસ) કપ પર્વાહી પીવાનો પર્યત્તન કરો.
5. નિવેશિકા અને નિકાલ બેગને નળીમાં આંટી (વળાંક અથવા ગુંચ) માટે ચકાસો. જો કોઈ આંટી હોય તો તેને સીધી કરો. જો તમે તેને સીધી ન કરી શકો તો તમારા આઈઆર ડોક્ટરની ઓફિસમાં કોલ કરો.

જો તમને કોઈ સમસ્યા દેખાય, તો પહેલાં તમારી નિવેશિકાસંભાળ પૂરી કરો અને પછી તમારા આઈઆર ડોક્ટરની ઓફિસમાં કોલ કરો.

તમારી પિતૃ નિકાલ નિવેશિકાને કેવી રીતે ફૂલશ કરવી

તમારી પિતૃ નિકાલ નિવેશિકાને કેવી રીતે ફૂલશ કરવી તે માટે એક વીડિયો બતાવવામાં આવ્યો છે.



Please visit www.mskcc.org/gu/cancer-care/patient-education/video/how-flush-your-biliary-abscess-drainage-catheter to watch this video.

તમારે તમારી નિવેશિકાને દરરોજ 2 વખત સામાન્ય ક્ષારથી ફૂલશ કરવી આવશ્યક છે. તમારા આઈઆર ડોક્ટર તમને જણાવશે કે તમારે 3 એમએલ, 5 એમએલ અથવા 10 એમએલ ક્ષારનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં.

1. તમારી વસ્તુને સ્વચ્છ, સપાટ સપાટી પર ગોઠવો. તમને જરૂર પડશે:
 - 1 (10 મિલી) પહેલાથી ભરેલ નોમર્લ સલાઇન સીરિજ
 - 1 આલ્ફોહોલ વાઇપ

- કચરાપેટી
2. તમારા હાથને સાબુ અને પાણીથી સંપૂણરપણે ધોઈ લો અથવા આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
- જો તમે સાબુ અને પાણીથી હાથ ધોઈ રહ્યા છો, તો તમારા હાથને ગરમ પાણીથી ભીના કરો અને સાબુ લગાવો. તમારા હાથને 20 સેકંડ સુધી ઘસો, પછી ધોઈ નાખો. તમારા હાથને કાગળના ટુવાલથી લુંછી નાખો. નળને બંધ કરવા માટે તે જ ટુવાલનો ઉપયોગ કરો.
 - જો તમે આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ખાતરી કરો કે તમારા હાથના તમામ ભાગોને તેનાથી ઢંકાયેલ છે. તમારા હાથ સૂકાય ત્યાં સુધી ઘસો.
3. રેપરમાંથી સામાન્ય ક્ષારવાળી સિરીજને બહાર કાઢો. ઢાંકણને વાળીને અને ખેંચીને કાઢી લો. ઢાંકણ બંધ હોય ત્યારે, હવાને સિરિજમાંથી બહાર કાઢો. આમ કરવા માટે, સિરિજને ઉપરની તરફ ખુલ્લી રાખો અને જ્યાં સુધી સામાન્ય ક્ષાર ટોચ પર ન આવે ત્યાં સુધી ધીમેથી પ્લન્જરને દબાવો. જો તમારા ડોક્ટરે તમને 10 mLથી ઓછું ફુલશ કરવાનું કહ્યું હોય, તો વધારાના ક્ષારને બહાર કાઢો. સિરીજને ટેબલ પર મૂકો. સિરિજની ટોચનો કોઈ પણ વસ્તુ સાથે સંપર્ક થવા દેશો નહીં.
4. આરામદાયક સ્થિતિમાં બેસો અથવા સૂઈ જાઓ. સ્ટોપકોકને ફેરવો જેથી નળ નિકાલ બેગ તરફ રહે (આકૃતિ 5 જુઓ).
5. સ્ટોપકોક પર આવેલા સોચ વગરના કનેક્ટરને આલ્કોહોલ વાઇપ વડે સાફ કરો. તેને 15 સેકંડ સુધી સારી રીતે સ્ક્રેબ કરો, પછી તેને 15 સેકંડ સુધી સૂકાવા દો. વાઇપને કચરાના ડબ્બામાં ફેકી દો.
6. સીરિજને સોચરહિત કનેક્ટરના સંપર્કરમાં રહે એમ ઉપર મૂકો. જ્યારે તમે પુશ કરતા હો ત્યારે કનેક્ટરને પકડી રાખો અને તેને તેની સ્થિતિમાં સ્થિર રાખવા સીરિજને ઘડિયાળની દિશામાં (જમણી તરફ) ફેરવો.
7. તમારી નિવેશિકાને અવરોધિત કરી શકે તેવી કોઈપણ વસ્તુને બહાર કાઢવા માટે તમારી નિવેશિકાને ઝડપથી ફુલશ કરો. જ્યાં સુધી તમે તમારી નિવેશિકામાં બધો સામાન્ય ક્ષાર દાખલ ન કરો ત્યાં સુધી પ્લન્જરને આગળ ધકેલીને આ કરો. પ્લન્જરને ક્યારેય પાછળની તરફ ખેચશો નહીં. તેને હંમેશા આગળ ધકેલો.
- જો તમારી નિવેશિકાને ફુલશ કરતી વખતે નીચેનામાંથી કોઈ પણ થાય, તો વધુ ક્ષારને દાખલ કરશો નહીં. પ્લન્જરને ઘક્કો મારવાનું બંધ કરો અને જો તમે નીચે મુજબ થાય તો તમારા આઇઆર ડોક્ટરની ઓફિસમાં કોલ કરો:
 - પીડા અનુભવો.
 - ક્ષારને અંદર ધકેલવામાં તકલીફ પડે.
 - તમારી નિવેશિકાની આસપાસ પરવાહી લીક થતું જુઓ.
8. જ્યારે સિરિજ ખાલી થઈ જાય, ત્યારે તેને સોચ વગરના કનેક્ટરને પકડી રાખી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં (ડાબે) ફેરવો. સિરિજને કાઢો અને તેને કચરાપેટીમાં ફેકી દો.

9. સ્ટોપકોકને પાછળની તરફ ફેરવો, જેથી નળ સોયવિહીન જોડાણ તરફ આવે (આકૃતિ 5 જુઓ). તમને કદાચ બેગમાં પર્વાહી વહેતું દેખાશે.

તમારી નિકાલ બેગને કેવી રીતે ખાલી કરવી

તમારે ખાલી કરવી જોઈએ અને દરરોજ ઓછામાં ઓછી 2 વખત તમારા નિકાલને માપવું જોઈએ. જો જરૂર પડે તો તમે તેને ખાલી કરી શકો છો અને વધુ વખત માપી શકો છો.

1. તમારી વસ્તુને સ્વચ્છ, સપાટ સપાટી પર ગોઠવો. તમને જરૂર પડશે:

- તમને હોસ્પિટલમાં મળેલ માપન પાતર્સ. જો તમારા માપવાના પાતરમાં કવર હોય તો તેને ઉતારી લો.
- બિનજંતુરહિત ગ્લોવ્ઝ.
- સુકો ગેજ અથવા 1 આલ્કોહોલ વાઇપ.
- નિકાલ લોગ અને પેન.
- કચરાપેટી.

2. તમારા હાથને સાબુ અને પાણીથી સંપૂર્ણાર્પણો ધોઈ લો અથવા આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

- જો તમે સાબુ અને પાણીથી હાથ ધોઈ રહ્યા છો, તો તમારા હાથને ગરમ પાણીથી ભીના કરો અને સાબુ લગાવો. તમારા હાથને 20 સેકંડ સુધી ઘસો, પછી ધોઈ નાખો. તમારા હાથને કાગળના ટુવાલથી લુંછી નાખો. નળને બંધ કરવા માટે તે જ ટુવાલનો ઉપયોગ કરો.
- જો તમે આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ખાતરી કરો કે તમારા હાથના તમામ ભાગોને તેનાથી ઢંકાયેલ છે. તમારા હાથ સૂકાય ત્યાં સુધી ઘસો.

3. નોન-સ્ટરાઇલ ગ્લોવ્ઝ પહેરી લો.

4. નિકાલ બેગને 1 હાથથી પકડી રાખો. બેગને ફ્રીલપ કરો જેથી ઢાંકણ ઉપરની તરફ રહે. બેગને ખોલવા માટે ઢાંકણને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં (ડાબી બાજુએ) વાળવા માટે તમારા બીજા હાથનો ઉપયોગ કરો.

5. બેગને કાળજીપૂવર્ક પાછી નીચેની તરફ પલટાવો અને પર્વાહીને માપણીના પાતરમાં ખાલી થવા દો. ઢાંકણને કન્ટેનરની બાજુઓ પર સ્પશર્થ થવા દેશો નહીં.

6. જ્યારે બેગ ખાલી થઈ જાય, ત્યારે બેગને બેક પાછી ઉપર ફેરવો. ઢાંકણને બંધ કરવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં (જમણી બાજુએ) ફેરવો.

7. જો કોઈ નિકાલ ઢાંકણમાં આવી જાય, તો તેને સાફ કરવાની ખાતરી કરો. તમે સૂકા ગોઝથી અથવા આલ્કોહોલ વાઇપથી ઢાંકણને સાફ કરી શકો છો. ગેજ અથવા વાઇપને કચરાના ડબ્બામાં ફેકી દો.

8. પાતરમાં રહેલા પર્વાહીની માતરાને માપો. ત્યારબાદ પર્વાહીને ટોયલેટમાં ફૂલશ કરો.

9. માપન પાતરને સાબુ અને પાણીથી સાફ કરો. તેને હવામાં સૂક્વવા દો.
10. તમારા ગ્લોવ્સ ઉતારો અને તેમને કચરાપેટીમાં ફેકી દો. પછી, તમારા હાથને ફરીથી સાફ કરવા માટે ઉપરના સ્ટેપ 2ને અનુસરો.
11. તમારા નિકાલ લોગમાં માપન પાતરમાં નિકાલની માતરા લખો. તમે આ સ્તરોતની પિરન્ટ આવૃત્તિમાં લોગને જોઈ શકો છો. તમારા ક્ષારના ફૂલશની દૈનિક કુલ માતરા (3 mL, 5 mL, or 10 mL) માંથી બાદ (ઓછું) કરવાનું સુનિશ્ચિત કરો.

તમારા યુરેસિલ® ડ્રેસિંગને કેવી રીતે બદલવું

યુરેસિલ ડ્રેસિંગ સિસ્ટમ તમારી નિવેશિકાને તમારી પિતૃત નળીઓમાંથી બહાર નીકળતું અટકાવવામાં મદદ કરે છે. ડિસ્ક તમારી નિવેશિકામાં જોડાયેલ છે. આ ડ્રેસીંગ ડિસ્કને ઢાંકે છે જે કેથેટરને એની જગ્યાએ રાખે છે.

તમારે અઠવાડિયામાં એકવાર તમારા યુરેસિલ ડ્રેસિંગને બદલવાની જરૂર છે. જો ડ્રેસિંગ ભીનું, ગંદુ, ઢીલું હોય અથવા તમારી ત્વચાથી દૂર જઈ રહ્યું હોય તો તેને બદલી નાંખો.

તમારા યુરેસિલ ડ્રેસિંગને કેવી રીતે બદલવું તેનો અહીં એક વીડિયો છે.




Please visit www.mskcc.org/gu/cancer-care/patient-education/video/how-change-your-uresil-dressing to watch this video.

તેમ છતાં તમારે તમારા ડ્રેસિંગને બદલવામાં મદદ કરવા માટે કોઈની જરૂર પડી શકે છે, તેમ છતાં તમે તમારી જાતે જ પુરવઠો એકત્રિત કરી શકો છો.

1. તમારી વસ્તુને સ્વચ્છ, સપાટ સપાટી પર ગોઠવો. તમને જરૂર પડશે:

- 1 યુરેસિલ એડહેસિવ ડ્રેસીંગ
- 3M™ નો સિટ્ટંગ બેરિયર ફિલ્મ
- એડહેસિવ દુર કરનાર વાઇપ્સ
- આલ્કોહોલ વાઇપ્સ
- બારીક કપડું
- માઇલ્ડ સાબુ અને એક કપ પાણી
- બિનજંતુરહિત ગ્લોવ્ઝની 2 જોડી
- 1 (2 ઈચ x 2 ઈચ) ટેલફા™
- કાતર

- જો તમે કેથગિર્પ બદલી રહ્યા હોવ તો કેથગિર્પ ચેનિજંગ કિટ
 - કચરાપેટી
2. આલ્કોહોલ વાઇપથી તમારી કાતર સાફ કરો. જો તમારી ટેલફા 2 ઈચ્ચ બાય 2 ઈચ્ચથી મોટી હોય, તો તમારે તેને તે કદમાં કાપવી જ જોઈએ. ત્યારબાદ, તે ટુકડામાંથી એક ચીરો કાપો (આકૃતિ 6 જુઓ) અને તેને બાજુ પર ગોઠવો.




આકૃતિ 6. ટેલ્ફામાં એક કાપો પાડો

3. આરામદાયક સ્થિતિમાં બેસો અથવા સૂઈ જાઓ. આ સમયે, તમારે તમારી મદદ માટે કોઈની જરૂર પડી શકે છે. ડરેસિંગ બદલનાર વ્યક્તિને નીચેની સૂચનાઓનું પાલન કરવા કહો.
4. તમારા હાથને સાબુ અને પાણીથી સંપૂર્ણરૂપણે ધોઈ લો અથવા આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
- જો તમે સાબુ અને પાણીથી હાથ ધોઈ રહ્યા છો, તો તમારા હાથને ગરમ પાણીથી ભીના કરો અને સાબુ લગાવો. તમારા હાથને 20 સેકંડ સુધી ઘસો, પછી ધોઈ નાખો. તમારા હાથને કાગળના ટુવાલથી લુંછી નાખો. નળને બંધ કરવા માટે તે જ ટુવાલનો ઉપયોગ કરો.
 - જો તમે આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ખાતરી કરો કે તમારા હાથના તમામ ભાગોને તેનાથી ઢંકાયેલ છે. તમારા હાથ સૂકાય ત્યાં સુધી ઘસો.
5. બિનજંતુરહિત ગ્લોવ્ઝની જોડી પર મૂકો.
6. નિકાલ બેગને તેની જગ્યાએ જકડી રાખતી સેફ્ટી પિન અથવા વેલકરો પટ્ટાને દૂર કરો. ખાતરી કરો કે નિકાલ બેગ એવી જગ્યાએ સ્થિત છે જ્યાંથી તે પડી ન શકે. તે પછી, કેથગિર્પ પરના પટ્ટાઓમાંથી નિવેશિકાને મુક્ત કરો.
- જો તમે કેથગિર્પ બદલી રહ્યા હોવ, તો કેથગિર્પની ધાર ફરતે એડહેસિવ રિમૂવરને સાફ કરો. આ ત્વચા પરથી દૂર કરે છે. એડહેસિવ રિમૂવર વાઇપ અને જૂની કેટગિર્પને કચરાપેટીમાં ફેકી દો.
7. નિવેશિકા પર દબાણ ન આવે તે માટે 1 આંગળીની મદદથી સિલિકોન ડિસ્કને તેની જગ્યાએ પકડી રાખો. યુરેસિલ ડરેસિંગમાં સિલટ્સ શોધો. આ સ્થળથી, હળવેથી ડિસ્કને પકડો અને ત્વચામાંથી ચીકણા પદાથરને હળવેથી દૂર કરો.

જો નિવેશિકાની આસપાસની ત્વચા સંવેદનશીલ હોય તો ડરેસિંગની કિનારીની ફરતે એડહેસિવ રિમૂવર વડે લૂછી લો. જ્યારે તમે ડરેસિંગને દૂર કરી રહ્યાં હોવ ત્યારે આ અગવડતા ઘટાડવામાં મદદ કરશો. એડહેસિવ રિમૂવર વાઈપ અને જૂના યુરેસિલ ડરેસિંગને કચરાપેટીમાં ફેકી દો.


8. તમારા ગ્લોવ્સ ઉતારો અને તેમને કચરાપેટીમાં ફેકી દો. પછી, તમારા હાથને ફરીથી સાફ કરવા માટે ઉપરના પગલા 4ને અનુસરો. જ્યારે તમારું કામ પતી જાય, ત્યારે બિનજંતુરહિત મોજાની નવી જોડી પહેરો.
9. એક ગેરી પેડ લો અને તેમને સાબુ અને પાણીથી ભીજવો. સિલિકોન ડિસ્કની આસપાસ અને નીચેની ત્વચાને સાફ કરવા માટે ગેરી પેડ્સનો ઉપયોગ કરો. આ જ ગેરી પેડનો ઉપયોગ કરીને, ડિસ્કની ઉપરની અને નીચેની બાજુઓને જ સાફ કરો. જ્યારે બીજી બાજુ સાફ કરી રહ્યા હોય ત્યારે ડિસ્કની 1 બાજુને હંમેશા મજબૂતીથી પકડી રાખો.
10. નવા ગેરી પેડથી ત્વચા અને સિલિકોન ડિસ્કને શુષ્ફક કરો.
11. કોઈપણ બાકી રહેલા સાબુને દૂર કરવા માટે આલ્કોહોલ વાઇપથી સિલિકોન ડિસ્કની ટોચને સાફ કરો. આલ્કોહોલ વાઇપથી ત્વચાને સાફ કરશો નહીં. આનાથી ત્વચા શુષ્ફક અને બળતરા થઈ શકે છે.
12. ડિસ્ક નિપ્પલ તરફ જુઓ. કાળી શાહીનું નિશાન ડિસ્ક નિપ્પલની બરાબર ઉપર હોવી જોઈએ (આકૃતિ 4 જુઓ). જો તે ખસી ગયું હોય, તો ડરેસિંગ બદલવાનું પૂરું કરો અને પછી તમારા આઈઆર ડોક્ટરની ઓફિસમાં કોલ કરો.
13. સિલિકોન ડિસ્કની નીચે નિવેશિકા દાખલ કરવાના સૂચળને ચકાસો. આ તે વિસ્તાર છે જ્યથીયાં નિવેશિકા શરીરમાં જાય છે. જ્યારે બીજા ભાગને ડિસ્કના તળિયે જોવા માટે ઉપર તરફ નમાવી રહ્યા હોય ત્યારે ડિસ્કની 1 બાજુને હંમેશા મજબૂતીથી પકડી રાખો. જો તમને આમાંની કોઈ પણ વસ્તુ દેખાય, તો ડરેસિંગ બદલવાનું પૂરું કરો અને પછી તમારા આઈઆર ડોક્ટરની ઓફિસમાં કોલ કરો:
 - લાલાશ.
 - સોજો.
 - નિકાલ સિસ્ટમ કે જેમાંથી દુગરંધ આવે છે.
 - પર્વાહી લીકેજ.
 - નિવેશિકા દાખલ કરવાના સૂચળની આસપાસ નવી પેશીઓની વૃદ્ધિ. આ હાનિરહિત છે, પરંતુ જો તે પીડાદાયક હોય તો તમારા આઈઆર ડોક્ટર દ્વારા તેને દૂર કરી શકાય છે.
14. સિલિકોન ડિસ્કની આસપાસની અને નીચેની ત્વચા પર 3M™ નો સ્લિંગ બેરિયર ફિલ્મ મૂકો. ડિસ્કની ટોચ પર જ્યાં તમે ડરેસિંગ મૂકુશો ત્યાં થોડું વધારે મૂકો. આ ત્વચાને સુરક્ષા આપે છે અને એડહેસિવને સારી રીતે ચોટવામાં મદદ કરે છે. ખાતરી કરો કે જ્યારે તમે ડિસ્કની નીચે બેરિયર ફિલ્મ દાખલ કરો ત્યારે તમે ડિસ્કને 1 હાથની જગ્યાએ પકડી રાખો છો.

15. તમે પહેલેથી જ કાપી નાખ્યું છે તે ટેલ્ફા લો. તેને સિલિકોન ડિસ્કની નીચે નિવેશિકાની આસપાસ સરકાવો (આકૃતિ 7 જુઓ). ટેલ્ફામાં ચીરો વ્યક્તિના પગ તરફ નીચેની તરફ હોવો જોઈએ. ટેલ્ફા ડિસ્ક નીચે ભીનાશ જમા થતી અટકાવશે.



આકૃતિ 7. કેથેટરની આસપાસ ડિસ્કની નીચે ટેલ્ફાને સરકાવવું

16. યુરેસિલ ડરેસીંગને ઉપર ઉઠાવો. કાપો ખૂલ્લો કરો અને તેને કેથેટરની આસપાસ મૂકો (જુઓ આકૃતિ 8). ટેલ્ફાના કાપાને આ કાપા સાથે એક લીટીમાં રાખો. એ સુનિશ્ચિત કરો કે ડરેસિંગ તળિયે એડહેસિવ (ચીકણું) હોય, જે ટોચ પર ચમકદાર હોય. ડિસ્કના નિપ્પલની નીચે પરંતુ ડિસ્કના ચપટા ભાગ પર ડરેસીંગ મૂકો. ડરેસિંગમાં ચીરો વ્યક્તિના પગ તરફ નીચેની તરફ હોવો જોઈએ.




આકૃતિ 8. યુરેસિલ ડરેસીંગ

17. યુરેસિલ ડરેસિંગમાં બેંકિંગ પેપરના 3 ટુકડાઓ હોય છે. બેંકિંગ પેપરને દૂર કરવા માટે સૌથી મોટા ટુકડાના ખૂણાથી શરૂ કરો. જ્યારે તમે ત્વચા પર એડહેસિવ લગાવો છો ત્યારે બેંકિંગ પેપરને ધીમે ધીમે દૂર કરો. તેને ચીકણું કરો જેથી તે ત્વચા પર ચોટી જાય. પરેક્લિટસ કરતા જશો એમ આ સહેલું થતું જશો. જો ડરેસિંગ યોગ્ય રીતે ચોટી રહ્યું ન હોય, તો ડરેસિંગ અને ટેલ્ફાને ઉતારી લો. સ્ટેપ 15થી ફરી શરૂ કરો.
18. બેંકિંગ પેપરના અન્ય 2 ટુકડા દૂર કરો, એક જ સમયે 1 જ. ત્વચા પર એડહેસિવને દબાવો અને તેને મુલાયમ

કરો જેથી તે ત્વચાને ચોટી રહે. ડરેસીગને વધુ સુરક્ષિત બનાવવા માટે ડરેસીગના કાપાની કિનારોને એકબીજા પર રાખો.

19. જો તમે પણ નિકાલ બેગ અથવા કેટગિરૂપ બદલતા હોવ, તો નીચે આપેલા “સ્ટોપકોક અને નિકાલ સિસ્ટમને કેવી રીતે બદલવી” વિભાગમાં આપવામાં આવેલી સૂચનાઓને અનુસરો. જો તમે અત્યારે ડરેસિંગ બદલી રહ્યા હોવ, તો વેલકરો પટ્ટા અથવા સેફ્ટી પિન વડે નિકાલ બેગને સુરક્ષિત કરો. પછી, નિવેશિકાને કેથગિરૂપ સાથે ફરીથી જોડો. આમ કરવા માટે:

- નિવેશિકાને ઉપકરણના પટ્ટાઓ પર મૂકો, જેથી તે કેથગિરૂપની મધ્યમાં રહે.
- કેથગિરૂપ પર 2 પટ્ટા છે: 1 છિદ્ર સાથે અને 1 સાથે દાંતાવાળી ધાર સાથે. કાણાંવાળા પટ્ટામાં બે ખૂલ્લા ભાગો હોય છે. બીજા પટ્ટાના નીચલા દ્વારમાં દાંતાવાળી કિનારીઓ સાથેનો પટ્ટો દાખલ કરો.
- કેથગિરૂપમાં નિવેશિકાને સુરક્ષિત કરવા માટે ખેચો (આકૃતિ 9 જુઓ). ખૂબ ચુસ્તપણો ખેચશો નહીં.



આકૃતિ 9. કેથેટરને CathGrip માં સુરક્ષિત કરવું

- ખાતરી કરો કે નિવેશિકા પર કોઈ ખેચાણ અથવા તણાવ નથી. નિવેશિકામાં સહેજ વળાંક (વકર) હોવો જોઈએ. જો નિવેશિકાને ખેચીને અથવા ચુસ્તપણો ખેચવામાં આવી રહ્યું હોય, તો કેથગિરૂપમાં નિવેશિકાની સ્થિતિ બદલો.
20. તમારા ગ્લોવ્સ ઉતારો અને તેમને કચરાપેટીમાં ફેકી દો. પછી, તમારા હાથને ફરીથી સાફ કરવા માટે ઉપરના પગલા 4ને અનુસરો.
21. યુરેસિલ ડરેસિંગ પર આજની તારીખ લખવા માટે માકરનો ઉપયોગ કરો. તમે છેલ્લે ક્યારે ડરેસિંગ બદલ્યું હતું તે આ તમને યાદ કરવામાં મદદ કરશો. તે તમને તે જાણવામાં પણ મદદ કરશો કે તમારે તેને ફરીથી ક્યારે બદલવાની જરૂર છે.

સ્ટોપકોક અને નિકાલ ઉપકરણને કેવી રીતે બદલવું

તમારે અઠવાડિયામાં એકવાર તમારી સ્ટોપકોક અને નિકાલ સિસ્ટમ બદલવાની જરૂર રહેશે.

તમારી પિતૃ નિકાલ નિવેશિકા પર સ્ટોપકોક અને નિકાલ સિસ્ટમ કેવી રીતે બદલવી તે માટે અહીં એક વીડિયો છે. સ્ટોપકોક અને નિકાલ સિસ્ટમને તમારી નિકાલ નિવેશિકા પર યુરેસિલ ડિસ્કથી બદલવા માટે સમાન સૂચનાઓને અનુસરો.

Please visit www.mskcc.org/gu/cancer-care/patient-education/video/how-change-stopcock-and-draining-system-your-biliary-abscess-catheter to watch this video.

1. તમારી વસ્તુને સ્વચ્છ, સપાટ સપાટી પર ગોઠવો. તમને જરૂર પડશે:

- નોન-સ્ટ્રાઇલ ગ્લોવ્ઝ
- 1 સોયરહિત કનેક્ટર
- 1 સ્ટ્રાઇલ 3-માગીર્ય સ્ટોપકોક
- 1 ડ્રેઇનેજ બેગ
- સેફ્ટી પિન અથવા વેલકર્રો પટ્ટા
- બારીક કપડું
- એડહેસિવ રીમૂવર વાઇપ
- જો તમે કેથગિર્પ બદલી રહ્યા હોવ તો કેથગિર્પ ચેન્ઝિંગ કિટ
- કચરાપેટી

2. નિકાલ બેગ ખાલી કરો અને તમારા નિકાલ લોગમાં નિકાલની માત્રા લખો. તમે આ સૂતરોતની પિસ્ન્ટ આવૃત્તિમાં લોગને જોઈ શકો છો. ઉપરના “તમારી નિકાલ બેગને કેવી રીતે ખાલી કરવી” વિભાગમાં આપેલા સૂચનાનું પાલન કરો.


3. તમારા હાથને સાબુ અને પાણીથી સંપૂર્ણરાપણો ધોઈ લો અથવા આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

- જો તમે સાબુ અને પાણીથી હાથ ધોઈ રહ્યા છો, તો તમારા હાથને ગરમ પાણીથી ભીના કરો અને સાબુ લગાવો. તમારા હાથને 20 સેકંડ સુધી ઘસો, પછી ધોઈ નાખો. તમારા હાથને કાગળના ટુવાલથી લુંછી નાખો. નળને બંધ કરવા માટે તે જ ટુવાલનો ઉપયોગ કરો.
- જો તમે આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ખાતરી કરો કે તમારા હાથના તમામ ભાગોને તેનાથી ઢંકાયેલ છે. તમારા હાથ સૂકાય ત્યાં સુધી ઘસો.

4. સોચ વગરના કનેક્ટર, 3-વે સ્ટોપકોક અને નિકાલ બેગ વડે પેકેજને ખોલો. નિકાલ બેગ સાથેનું પેકેજ બાજુ પર મૂકો.
5. પેકેજ ખોલ્યા બાદ, તમારા હાથને ફરીથી સાફ્ કરવા માટે ઉપરના સ્ટેપ તને અનુસરો.
6. સોચ વગરના કનેક્ટરના પાયામાંથી રક્ખણાત્મક કવરને દૂર કરો અને તેને કચરાપેટીમાં ફેકી દો. સ્ટોપકોકના સેન્ટર પોટર સાથે સોચ વગરના કનેક્ટરને જાડો (આકૃતિ 5 જુઓ). સ્ટોપકોકને નીચે મૂકો.
7. તેના પેકેજમાંથી નિકાલ બેગને બહાર કાઢો. નિકાલ બેગમાંથી ટ્યુબિંગને ફેરવીને સ્ટોપકોક સાથે જાડો. તેને બંધ કરવા માટે ઢાંકણને ઘડિયાળના કાંટાની દિશામાં (જમણી બાજુએ) ફેરવો. આ ઢાંકણને નિકાલ પોટર કહેવામાં આવે છે. નિકાલ પોટર બંધ કરવાથી લીકેજ થતું અટકે છે.
8. એસેમ્બલ કરેલ ડરેઇનેજ બેગને તેના પેકેજમાં રાખો. જ્યાં સુધી તમે તેને નિવેશિકાથી જોડવા માટે તૈયાર ન થાઓ ત્યાં સુધી આ તેને સાફ્ રાખશો.
9. તમારા હાથને ફરીથી સાફ્ કરવા માટે ઉપરના પગલાં તને અનુસરો. તે પછી, બિનજંતુરહિત ગ્લોવ્ઝ પહેરો.
10. નિકાલ બેગને તેની જગ્યાએ જકડી રાખતી સેફ્ટી પિન અથવા વેલકરો પટ્ટાને દૂર કરો. ખાતરી કરો કે નિકાલ બેગ એવી જગ્યાએ સિસ્થત છે જ્યાંથી તે પડી ન શકે. ખાતરી કરો કે નવી નિકાલ બેગ તમારી પહોંચની અંદર છે. તે પછી, કેથગિર્પ પરના પટ્ટાઓમાંથી નિવેશિકાને મુક્ત કરો.
 - જો તમે કેથગિર્પ બદલી રહ્યા હોવ, તો કેથગિર્પની ધાર ફરતે એડહેસિવ રિમૂવરને સાફ્ કરો. આ ત્વચા પરથી દૂર કરે છે. એડહેસિવ રિમૂવર વાઇપ અને જૂની કેટગિર્પને કચરાપેટીમાં ફેકી દો.
11. ગોઝ પેડ લો અને તેને સોચ વગરના કનેક્ટરની નીચે મૂકો. જ્યારે ગોઝને પકડો, ત્યારે નિવેશિકામાંથી જૂની સ્ટોપકોક અને નિકાલ સિસ્ટમને દૂર કરો. તેમને કચરાપેટીમાં ફેકી દો.
12. નવા સ્ટોપકોક અને ડરેઇનેજ સિસ્ટમને જલ્દીથી જોડી દો. સ્ટોપકોકનો “બંધ” નળ સોચ વિનાના કનેક્ટર તરફ છે તે સુનિશ્ચિત કરો (આકૃતિ 5 જુઓ).
13. જો તમે કેટગિર્પને બદલી રહ્યા હોવ, તો નવી કેટગિર્પ મૂકવા માટે જગ્યા પસંદ કરો. કેથગિર્પ અને નિકાલ બેગ ટ્યુબિંગ નિવેશિકા દાખલ કરવાના સ્થળ કરતા નીચે સિસ્થત હોવી જોઈએ. આનાથી તેને કાઢવામાં મદદ મળશો. ખાતરી કરો કે જ્યારે તમે ઉભા હો કે પડી રહ્યા હો ત્યારે એ બંને નીચે રહે છે. જ્યારે નિવેશિકા જોડવામાં આવે છે, ત્યારે નિવેશિકા પર કોઈ ખેચાણ અથવા તણાવ હોવું જોઈએ નહીં. નિવેશિકામાં સહેજ વળાંક (વકરુ) હોવો જોઈએ.
14. કેથગિર્પ જ્યાં મૂકવામાં આવશે તે સ્થળ તપાસો. ખાતરી કરો કે તમે વિસ્તાર પસંદ કરો છો કે જે લાલ અથવા બળતરાવાળો નથી. કાતર અથવા વાળના ટરીમરથી સ્થળ પરના લાંબા વાળને કાપી નાખો. રેઝનો ઉપયોગ કરવાનું ટાળો, જે તમારી ત્વચાને કાપી શકે છે અને તેમાંથી લોહી નીકળી શકે છે.
15. કેથગારીપ પેકેજને ખોલો.
16. કેટગિર્પ ચેનિજંગ કિટથી આલ્કોહોલ વાઇપથી સ્થળને સાફ્ કરો. આ તમારી ત્વચામાંથી લોશન અથવા સાબુ

જેવા તેલ અને ઉત્પાદનોને દૂર કરે છે. આગળના પગલા પર આગળ વધતા પહેલાં આલુકોહોલને સંપૂર્ણરૂપણે સૂકાવા દો.


17. કેથગિરૂપ ચેન્જિંગ કિટથી સિકુન પરૈપ વડે સ્થળને સાફ્ કરો. આ તમારી ત્વચાને સુરક્ષિત કરે છે અને કેથગિરૂપને તમારી ત્વચા સાથે ચોટી રહેવામાં મદદ કરે છે. આગલા પગલા પર આગળ વધતા પહેલાં ત્વચાને સંપૂર્ણરૂપણે સૂકાવા દો.
18. કેથગારીપમાં બેંકિંગ પેપરના 2 ટુકડાઓ છે. તમે બેંકિંગ પેપરના દરેક ટુકડાને 1 પછી એક દૂર કરશો. મધ્યમાંથી શરૂ કરો અને કાગળને ઘીમે-ઘીમે કેગિરૂપની 1 બાજુએથી દૂર કરો (આકૃતિ 10 જુઓ). જ્યારે તમે કાગળને દૂર કરો છો, ત્યારે તમારી ત્વચા પર એડહેસિવ દબાવો. તેને નીચે કરો જેથી તે તમારી ત્વચાને ચોટી રહે. બીજીએ બાજુએ એ પરકિર્યા ફરીથી કરો.



આકૃતિ 10. કેથગિરૂપનું બેંકિંગ પેપર દૂર કરી રહ્યા છીએ

19. કેથગિરૂપને તમારી ત્વચા પર 5 સેકંડ માટે હળવેથી દબાવો. આ તેને તમારી ત્વચા પર ચોટાડી દેશો.
20. નિવેશિકાને કેથગિરૂપ સાથે ફરીથી જોડો. આમ કરવા માટે:
 - નિવેશિકાને ઉપકરણના પટ્ટાઓ પર મૂકો, જેથી તે કેટગિરૂપની મધ્યમાં રહે.
 - કેથગિરૂપ પર 2 પટ્ટા છે: 1 છિદ્ર સાથે અને 1 સાથે દાંતાવાળી ધાર સાથે. કાણાંવાળા પટ્ટામાં બે ખૂલ્લા ભાગો હોય છે. બીજા પટ્ટાના નીચલા દ્વારમાં દાંતાવાળી કિનારીઓ સાથેનો પટ્ટો દાખલ કરો.
 - કેથગિરૂપમાં નિવેશિકાને સુરક્ષિત કરવા માટે ખેંચો (આકૃતિ 9 જુઓ). ખૂબ ચુસ્તપણે ખેંચશો નહીં.
 - ખાતરી કરો કે નિવેશિકા પર કોઈ ખેચાણ અથવા તણાવ નથી. કેથેટર એકદમ હળવી ઝૂકેલ હોવી જોઈએ. જો નિવેશિકાને ખેંચીને અથવા ચુસ્તપણે ખેચવામાં આવી રહ્યું હોય, તો કેથગિરૂપમાં નિવેશિકાની સિથ્યતિ બદલો.

21. નિકાલ બેગને વેલકરો પટ્ટાથી અથવા સેફ્કુટી પિન વડે સુરક્ષિત કરો. જો તમે સેફ્કુટી પિનનો ઉપયોગ કરી રહ્યા છો, તો બેગને તમારા કપડાંના કમરપટ્ટા સાથે જોડો. જો તમે વેલકરો પટ્ટાનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો બેગને તમારા પગ સાથે જોડો. બેગને નિવેશિકાના સ્તરની નીચે મૂકો. આને કારણે નિવેશિકા ગુરુત્વાકષરણ દ્વારા બહાર નીકળી જાય છે, જે નિકાલને નીચેની તરફ ખેચે છે (આકૃતિ 11 જુઓ).



આકૃતિ 11. કેથેટરની નીચે ડરેઇનેજ બેગ

22. નવી નળીમાં પર્વાહી વહી રહ્યું છે કે નહીં તે જોવા માટે ચકાસો.
23. તમારા ગ્લોવ્સ ઉતારો અને તેમને કચરાપેટીમાં ફેકી દો. પછી, તમારા હાથને ફરીથી સાફ કરવા માટે ઉપરના પગલા ઢને અનુસરો.

તમારી પિતૃત નિકાલ નિવેશિકા સાથે કેવી રીતે સ્નાન કરવું

તમે સ્નાન લઈ શકો છો. જ્યારે તમારી પાસે તમારી નિવેશિકા હોય ત્યારે સ્નાન ન કરો.

તમે સ્નાન કરો તે પહેલાં, તમારી નિકાલ બેગને પકડેલા બેલ્ટ અથવા ઇલાસ્ટિક બેન્ડને દૂર કરો. નિકાલ બેગ ખાલી કરો. તે પછી, નિકાલ બેગને નિવેશિકાની નજીક તમારા શરીર પર ચોટાડો. જો તમે ઇચ્છા કરો, તો તમે બેગને તમારી કમર અથવા પિંડી સાથે જોડવા માટે વેલકરો પટ્ટાનો ઉપયોગ કરી શકો છો.

તમારી નિવેશિકા પરના ડરેસિંગને ક્યારેય ભીનું ન કરો. તમે સ્નાન કરો પહેલાં, તમારા ડરેસિંગને એક્વાગાડર[®] જેવા એક વખત વાપરી શકાય તેવા વોટરપરૂફ કવરથી ઢાંકી દો. તમે વોટરપરૂફ કવર ઓનલાઇન ખરીદી શકો છો. જો તમારી પાસે વોટરપરૂફ કવર ન હોય તો તેને સૂકવવા માટે તમારા ડરેસિંગની ઉપર ટેપ પ્લાસ્ટિક રેપ અથવા ગેલન

સાઇઝની બેગ મૂકો.

વોટરપૂર્ફ કવર પર મૂકવા માટે:

1. ઉપરથી અને બાજુની પટ્ટીઓને દુર કરો.
2. ટોચની ધારને તમારા ડરેસિંગની ઉપર મૂકો. વોટરપૂર્ફ કવરની ટેપને તમારા ડરેસિંગને સ્પર્શશર્વા દેશો નહીં. જ્યારે તમે સ્નાન કયાર પછી વોટરપૂર્ફ કવર ઉતારો છો, ત્યારે તે તમારા ડરેસિંગને ઉપર લઈ શકો છો. તમારા ડરેસિંગ પર કવરને લીસું બનાવો.
3. નીચેનીની પટ્ટીને દુર કરો. વોટરપૂર્ફ કવરની નીચેની ધાર તમારા ડરેસિંગની નીચે હોય તે સુનિશ્ચિત કરો. તમારી નિવેશિકાને વોટરપૂર્ફ કવરમાં મૂકો જેથી તે સંપૂર્ણશર્પણો ઢંકાઈ જાય.
4. વોટરપૂર્ફ કવરની તળિયાની ધારને નીચેની તરફ લીસી કરો.

જ્યારે તમે સ્નાન કરતા હોવ, ત્યારે તમારું ડરેસિંગ સૂકું રાખો. હેન્ડહેલ્ડ શાવરહેડનો ઉપયોગ કરવાથી પાણીને ડરેસિંગથી દૂર રાખવામાં મદદ મળી શકે છે.

15 મિનિટથી વધુ સમય સુધી સ્નાન કરશો નહીં. હુંફાળા પાણીનો ઉપયોગ કરો, પણ ગરમ પાણીનો નહીં. આ વોટરપૂર્ફ કવરને બહાર આવતા અટકાવવામાં મદદ કરશો.

તમારા સ્નાન પછી, તરત જ વોટરપૂર્ફ કવરને કાઢી નાખો. ખાતરી કરો કે તમારું ડરેસિંગ સ્વચ્છ અને કોરું છે. જો તે ગંદુ કે ભીનું હોય તો તેને બદલી નાખો. ભીનું ડરેસીંગ એ ત્વચાની સમસ્યાઓ માટેનું સામાન્ય કારણ છે.

જ્યારે તમારી પાસે પિતૃત નિકાલ નિવેશિકા હોય ત્યારની પરવૃત્તિતાઓ

- તમે કામ પર જઈ શકો છો અને તમારા કેથેટર લગાવેલ હોય એ સ્થિતિમાં કસરત કરી શકો છો. એવી હિલચાલ ટાળો જેમાં એક બાજુથી બીજી બાજુ ખેચવાનો સમાવેશ થાય છે. એવી પરવૃત્તિતાઓ ટાળો જ્યાં તમારે જૂકવું પડે. આ રીતે આગળ વધવાથી તમારી નિવેશિકાને વિસ્થાપિત (ખસી) શકે છે.
- તમારી નિવેશિકા પાણીમાં ડુબેલી (પાણીની અંદર) ન હોવી જોઈએ. તરવું નહીં, સ્નાન ન કરવું, ન તો ગરમ ટબનો ઉપયોગ કરવો. જો તમે વેકેશનનું આયોજન કર્યું હોય તો તમારા આઈઆર ડોક્ટર સાથે વાત કરો. જ્યારે તમે દૂર હોવ ત્યારે તેઓ તમને તમારી નિવેશિકા સંભાળની યોજના બનાવવામાં મદદ કરશો.
- તમારા શરીર પર કેટગ્રેપથી હંમેશાં ટ્યુબિંગને સુરક્ષિત કરો. ખાતરી કરો કે નિવેશિકા પર કોઈ ખેચાણ અથવા તણાવ નથી. કેથેટર એકદમ હળવી જૂકેલ હોવી જોઈએ. જો નિવેશિકાને ખેચીને અથવા ચુસ્તપણો ખેચવામાં આવી રહ્યું હોય, તો કેથેગ્રેપમાં નિવેશિકાની સ્થિતિ બદલો.
- જ્યારે તમે કપડાં પહેરી રહ્યા હોવ, ત્યારે ખાતરી કરો કે તમે તમારી નિવેશિકાને ખેચશો નહીં. પેન્ટીહોઝ

અથવા બેલ્ટ જેવા કાપડ વડે ટ્યુબિંગને સંકોચાવા દેશો નહીં.


- સૂતી વખતે કેથેટર ઉપર શરીર આવી ન જાય એવો પર્યાસ કરો. આ તમારી નિવેશિકાને સંકોચાતા અટકાવશે.

તમારી પિતૃત નિકાલ નિવેશિકામાં નિયમિત ફેરફાર

પિતૃત નિકાલ નિવેશિકા મોટે ભાગે દર 8થી 12 અઠવાડિયે (2થી 3 મહિના) બદલવામાં આવે છે. તમારા આઇઆર ડોક્ટર તમને વધુ કે ઓછી વખત આવવાનું કહી શકે છે. તમે તમારી રીતે કેથેટરને નિયમિત રીતે બદલવાની અપોઈન્ટમેન્ટ મેળવી શકો છો. એપોઈન્ટમેન્ટ લેવા માટે તમારા આઇઆર ડોક્ટરની ઓફિસમાં સમય કરતાં ઓછામાં ઓછા 3 અઠવાડિયા વહેલા કોલ કરો.

આંતરિક-બાહ્ય પિતૃત નિકાલ નિવેશિકા માટે વિશેષ સૂચનાઓ

જો તમારી પાસે આંતરિક-બાહ્ય પિતૃત નિકાલ નિવેશિકા હોય, તો તમારા આઇઆર ડોક્ટર તમને કેપિંગ ટેસ્ટ કરાવવાની છયણા રાખી શકે છે. તેઓ પરીક્ષણ દરમિયાન તમારી નિવેશિકાને બંધ કરશે. તમારી નિવેશિકાને બંધ કરવાથી તમારા પિતૃતને તમારા શરીરમાં નિવેશિકા મારફતે ખસેડવામાં મદદ મળે છે. જો તમે પરીક્ષણ પાસ કરો છો, તો તમારે નિકાલ બેગની જૂર રહેશે નહીં (આકૃતિ 12 જુઓ).



આકૃતિ 12. કેપ ચઢાવેલ બાઇલરી ડ્રેઇનેજ કેથેટર

તમે ઘરે જાઓ તે પહેલાં તમારી નિવેશિકા હોસ્પિટલમાં બંધ થઈ શકે છે. મોટે ભાગે, થોડા દિવસો સુધી ઘરે રહ્યા પછી, તમારે તમારી નિવેશિકાને જાતે બંધ કરવું પડશે.

તમારી નિવેશિકાને કેવી રીતે બંધ કરવું તે અંગેની સૂચનાઓ માટે *How to Cap Your Biliary Drainage Catheter* (www.mskcc.org/cancer-care/patient-education/how-cap-your-biliary-drainage-catheter) વાંચો.

તમારા આરોગ્યસંભાળ પરદાતાને ક્યારે કોલ કરવો

જો તમારી પાસે નીચેનામાંથી કોઈ પણ હોય તો તમારા આઇઆર ડોક્ટરને કોલ કરો:

- તમને 100.4 °F (38 °C) અથવા તેથી વધુ તાવ હોય છે.
- તમારી નિવેશિકામાંથી કોઈ નિકાલ નથી, અથવા નિકાલની માતરા સામાન્ય કરતા ઘણી ઓછી છે.
- ડ્રેઇનેજમાં લોહી જેવું દેખાય.
- નિવેશિકા દાખલ કરવાના સ્થાન આસપાસ લિકેજ છે.
- તમે તમારી નિવેશિકાને ફૂલશ કરી શકતા નથી અથવા જ્યારે તે ફૂલશ થાય છે ત્યારે તે લીક થાય છે.
- કાળી શાહીના નિશાનનું સ્થાન બદલાઈ ગયું છે.
- જ્યારે 3-વે સ્ટોપકોક સીધી સિથ્યતિમાં હોય ત્યારે તમારી નિવેશિકામાંથી કોઈ નિકાલ નથી.
- 3-વે સ્ટોપકોક તૂટી ગયો છે અથવા ખુલી ગયો છે.
- નળીમાં આંટી છે જેને તમે સીધી કરી શકતા નથી, જેના કારણે બ્લોકેજ થાય છે.
- તમને બ્લોકેજના લક્ષણો છે, જેમ કે તમારી નિવેશિકામાંથી પીડા અથવા લિકેજ.
- તમને નિવેશિકા દાખલ કરવાના સ્થાન પર દુખાવો, મૃદુતા અથવા સોજો છે.
- નિવેશિકા દાખલ કરવાના સ્થાનની આસપાસની ત્વચા લાલ, બળતરા અથવા તે સામાન્ય રીતે જે રીતે દેખાય છે તેનાથી અલગ દેખાય છે.
- ઉબકા (એવું લાગે છે કે તમને ઉલટી થશે).
- તમને નવો કમળો અથવા કમળો છે જે વધુ ખરાબ થઈ રહ્યો છે.
- તમને તમારી નિવેશિકા વિશે કોઈપણ પરશ્નનો અથવા ચિંતાઓ છે.

સંપર્કર્ની માહિતી

જો તમને કોઈ પણ પરશ્નનો અથવા ચિંતાઓ હોય, તો તમારા આઈઆર ડોક્ટરની ઓફિસમાં કોલ કરો. તમે તેમને સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કોલ કરી શકો છો. સાંજે 5 વાગ્યા પછી, શનિ-રવિમાં કે રજાના દિવસે 212-639-2000 પર કોલ કરો. કોલ પર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ફેલો માટે પૂછો.

તમારી પિતૃત નિકાલ નિવેશિકા વસ્તુઓનો ઓડર કેવી રીતે આપવો

જ્યારે તમે ઘરે જશો, ત્યારે તમારી સંભાળ ટીમ તમને 2 અઠવાડિયા સુધી ચાલે તેટલી વસ્તુ પુરવઠો આપશો. જ્યારે તમને વધુ વસ્તુની જરૂર હોય, ત્યારે તમે તમારી મુલાકાતી નસર સેવા દ્વારા તેમને ઓડર આપી શકો છો. જો તમે તમારી મુલાકાતી નસર સેવા મારફતે વસ્તુ મંગાવી શકતા ન હો, તો તમારા આઈઆર ડોક્ટરની ઓફિસમાં કોલ કરો. અહીં તમને જોઈતી વસ્તુઓની યાદી આપવામાં આવી છે:

વસ્તુ	પૂરી પાડેલ વસ્તુઓ
3-વે સ્ટોપકોક	1-1
એડહેસિવ રિમુવર	1 બોક્સ
આલ્કોહોલ વાઇપ્સ	1 બોક્સ
CathGrip	1-1
નિકાલ ડિસ્ચાજર કિટ (4-અઠવાડિયા માટે વસ્તુ)	1 કીટ
સોથરહિત કનેક્ટર	1-1
નોન-સ્ટારાઇલ ગ્લોવ્ઝ	1 બોક્સ
સાદું બારીક પાતળું કાપડ	1 પેકેજ
સ્ક્રિન પરેપ	1 બોક્સ
ટેલ્ફા	1-1
યુરેસિલ એડહેસિવ ડ્રેસીંગ	1 બોક્સ
યુરેસિલ ડ્રેનેજ બેગ	1-1

પરીક્રિલ્ડ (પહેલાથી ભરેલ) સીરિજ

પરી-ક્રિલ્ડ નોમર્સ સલાઈન સીરિજ માટે પિર્સિકર્શનની જરૂર પડશે. તમે IR ક્રિલનિક પરથી પિર્સિકર્પ્શન મેળવી શકશો.

જો તમારી સ્થાનિક ફામર્સીમાં સિરિજ ન હોય, તો તમે તેને મેમોરિયલ હોસ્પિટલની બહારની ફામર્સીમાંથી મેળવી શકો છો. તે સોમવારથી શુક્રવાર સુધી, સવારે 9 થી સાંજે 5:45 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ફામર્સી સુધી પહોંચવા માટે 646-888-0730 પર કોલ કરો.

એમએસકે પાસે અન્ય સ્થળોએ રિટેલ ફામર્સીઓ પણ છે. તમારી નજીક એમએસકે રિટેલ ફામર્સી શોધવા માટે www.msk.org/locations/visiting-us/retail-pharmacy ની મુલાકાત લો.

નિકાલ લોગ

તારીખ	સવારનું આઉટપુટ	બપોરનું આઉટપુટ	કુલ (કૂલશનો જથ્થો બાદ કરો)	નોંધો

If you have questions or concerns, contact your healthcare provider. A member of your care team will answer Monday through Friday from 9 a.m. to 5 p.m. Outside those hours, you can leave a message or talk with another MSK provider. There is always a doctor or nurse on call. If you're not sure how to reach your healthcare provider, call 212-639-2000.

વધુ રિસોસર માટે, અમારી વચ્ચુરાયલ લાઈબ્રેરી www.mskcc.org/peની મુલાકાત કરો

About Your Biliary Drainage Catheter - Last updated on February 2, 2024

તમામ અધિકાર અને માલિકી હક મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર દ્વારા આરક્ષિત છે